



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૧/૦૭/૨૦૧૯ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૨૨૦/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૬ કેસ કરી, ૩૦ વ્યક્તિઓને ઝડપી, ૧૦૯ લીટર દેશી દારૂ, ૪૯ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧૦ બિયર ટીન અને ૧ સ્ફૂટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૬ કેસ કરી, ૨૯ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૯૮,૨૯૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૨૨૧/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૪૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.હી.૯૩ મુજબ ૮ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૨૨૨/૧૯

સરખેજ: પરેશભાઈ મંગાભાઈ રાવળ (ઉ.વ.૨૭)(રહે.રાવળ વાસ, જુની પોસ્ટ ઓફીસ રોડ, સરખેજ) એ તા.૨૦/૦૭/૨૦૧૯ નારોજ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે માર્ચ/૨૦૧૮ થી આજદિન સુધીના સમયગાળા દરમિયાન આરોપી મોહંમદ સમીર ગકુરભાઈ શેખે પરેશભાઈના નામે અલગ-અલગ ફાઇનાન્સ કંપનીમાંથી લોન મેળવી તેમજ હોન્ડા એક્ટીવાની પરેશભાઈના નામે લોન કરી, તમામ લોનના હપ્તા નહીં ભરી કુલ રૂપિયા ૨,૪૮,૬૦૧/- તથા તમામ લોન ઉપરની પેનલ્ટીના રૂપિયા નહીં ભરી પરેશભાઈ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.કે.પંડ્યા ચલાવે છે.

પાલડી: રીકેશભાઈ અશોકકુમાર નાગર (ઉ.વ.૩૦)(રહે.મુમનાવાડ પંડિતજીની પોળ સાંભગપુર) એ તા.૨૦/૦૭/૧૯ નારોજ પાલડી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૩/૦૭/૧૯ બપોરના ૩/૦૦ વાગ્યાના સુમારે પાલડી ચાર રસ્તા વી.આર.એલ ટ્રાવેલ્સ આગળ આરોપી મહીપાલસિંહ જીતેન્દ્રસિંહ જોધા (રહે. ટીપી-૪૪, રોયલ વૃદાંવન સોસાયટી, ચાંદખેડા) એ રીકેશભાઈની કંપનીના માલિક અજીતકુમાર જૈનના રોકડ રૂપિયા ૧,૬૦,૦૦,૦૦૦/- બેંકલોર અલગ-અલગ પાર્ટીઓને પેમેન્ટ કરવા માટે લઈ જઈ, સમયસર બેંકલોર નહીં પહોંચી, પેમેન્ટ નહીં કરી આજદિન સુધી પરત નહીં, વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.બી.જાડેજા ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૧૨૨૩/૧૯

સોલા હાઇકોર્ટ: હેમંતભાઈ ગોવીંદભાઈ દરજી (ઉ.વ.૪૫)(રહે.સુયોગ એપાર્ટમેન્ટ જેબર સ્કુલ સામે થલતેજ) એ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૯/૦૭/૧૯ બપોરના ૧/૦૦ થી ૩/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે કામ કરતો આરોપી થાવારચંદ વક્તાજી મીણા (ઉ.વ.૨૮) (રહે. રોકડકાકાની ચાલી હેબતપુર ગામ, મુળ વતન: રાજસ્થાન) એ હેમંતભાઈના ઘરના બેડરૂમમા પર્સમાંથી વસ્તુઓ કુલ કિંમત રૂપિયા ૧,૮૫,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગયો છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી ડી.એચ.ગઢવી ચલાવે છે.

વાડજ: ઉર્વીબહેન વા/ઓ રાજેશભાઈ સોમાલાલ (ઉ.વ.૨૧)(રહે.અશોકવિહાર મોટેરા) એ તા.૨૦/૦૭/૧૯ નારોજ વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૦૭/૧૯ બપોરના ૧/૦૦ વાગ્યાના સુમારે ઉસ્માનપુરા ગુજરાત વિદ્યાપિઠની બાજુમા ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં પાર્ક કરેલ પોતાના એક્ટીવાની ડેકી ખોલી, અજાણી વ્યક્તિ ડેકીમાંથી રોકડ રૂપિયા ૫૦,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી આર.આર.મિશ્રા ચલાવે છે.

કાગડાપીઠ: સોહિનીબહેન વા/ઓ રમેશભાઈ પટેલ (ઉ.વ.૫૯)(રહે. કિષ્નાશ્રય એપાર્ટમેન્ટ રામજી મંદિર સામે પુનિતમાર્ગ મણિનગર) એ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૯/૦૭/૨૦૧૯ સાંજના ૫/૩૦ થી ૫/૪૫ વાગ્યા દરમ્યાન સારંગપુર એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડ થી કાંકરીયા હિરાભાઈ માર્કેટ સુધીની ઓટોરીક્ષાની મુસાફરી દરમ્યાન રસ્તામા ઓટોરીક્ષા ચાલકની મદદગારીથી રિક્ષામાં બેઠેલ એક પુરૂષ અને મહીલાએ ભેગા મળી સોહિનીબહેનની નજર ચુકવી હાથમા પહેરેલ સોનાની બંગડી કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- ચોરી કરી લઈ લીધી હતી. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.બી.પટેલ ચલાવે છે.

સોનાની ચેઈન ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૧૨૨૪/૧૯

માધવપુરા: વિજયકુમાર નટવરભાઈ રાઠોડ (ઉ.વ.૨૬)(રહે.ન્યુ પરમેશ્વરપાર્ક સોસાયટી વિકટરનગર ચાર રસ્તા સીવીલ હોસ્પિટલ પાછળ અસારવા) તા.૧૯/૦૭/૧૯ રાતના ૧૦/૦૦ વાગ્યાના સુમારે મુસાસુવા કબ્રસ્તાન પાસેના બ્રીજ ઉપરથી એક્ટીવા ચલાવી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષોએ વિજયકુમારના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ વિજયકુમાર રાઠોડે માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જે.ડી.બારોટ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.